



**DD-001-001458**      Seat No. \_\_\_\_\_

**B. A. (Sem. IV) (CBCS) Examination**

April / May - 2015

**Geography : Paper - VIII**  
**(Element of Oceanography)**  
**(Optional - I) (Elec. - 1)**

**Faculty Code : 001**  
**Subject Code : 001458**

Time : **2½ Hours**

[Total Marks : **70**

- સૂચના :** (૧) બધા પ્રક્રિયાત છે.  
(૨) પ્રક્રિયાની જમણી બાજુ લખેલ અંક ગુણ દર્શાવે છે.

૧ નીચેના બહુ વિકલ્પ પ્રક્રિયા (M.C.Q.)માંથી સાચા જવાબ શોધી ઉત્તરવહીમાં તેના **૨૦** જવાબ લખો :

- (૧) પૃથ્વી સપાટી પર પાણી અને જમીનની સરેરાશ વહેચણી \_\_\_\_\_ છે.  
(A) 50% - 50%                                  (B) 71% - 29%  
(C) 20% - 80%                                    (D) 90% - 10%
- (૨) \_\_\_\_\_ પરવાળાના ખરાબાનો પ્રકાર નથી.  
(A) પરતટીય ખરાબા                        (B) કંકળાકાર ખરાબા  
(C) જતીય ખરાબા                            (D) બાધક ખરાબા
- (૩) અખાતી ગરમ પ્રવાહ અને લાખડોરનો ઠંડો પ્રવાહ \_\_\_\_\_ પાસે મળે છે.  
(A) ન્યૂયોર્ક                                    (B) નોર્વ  
(C) આઈસલેન્ડ                                (D) ન્યૂઝાઉન્ડલેન્ડ
- (૪) સમુક્રતળના છીછરા ધીમા ઢાળવાળા સપાટ અને પહોળા ભાગને \_\_\_\_\_ કહેવામાં આવે છે.  
(A) ખંડીય છાજલી                            (B) ખાઈઓ  
(C) ગરમ સમુક્ર મેઘાનો                    (D) ખંડીય ઢાળ

- (૫) ગ્રાન્ટ બેન્ક \_\_\_\_\_ ઉત્પાદનનો મહત્વનો ક્ષેત્ર છે.  
 (A) નાઈટ્રોલીસ  
 (B) સમુદ્રી માઇલી  
 (C) બોક્સાઈટ  
 (D) ખનિજ તેલ
- (૬) સમુદ્ર જળસપાટીનું સરેરાશ વાર્ષિક તાપમાન \_\_\_\_\_ છે.  
 (A)  $17^{\circ}\text{C}$   
 (B)  $40^{\circ}\text{C}$   
 (C)  $10^{\circ}\text{C}$   
 (D)  $25^{\circ}\text{C}$
- (૭) સમુદ્રતળના ભૂપૃષ્ઠનો સૌથી વધુ 47% વિસ્તાર \_\_\_\_\_ રોકે છે.  
 (A) ખંડીય છાજલી  
 (B) ઊરી ખાઈઓ  
 (C) ગહન સમુદ્ર મેદાનો  
 (D) ખંડીય ઢાળ
- (૮) નીચેનામાંથી ક્યા મહાસાગર કે સાગરમાં ક્ષારતાનું પ્રમાણ સૌથી વધુ છે ?  
 (A) પેસેફિક મહાસાગર  
 (B) ઉત્તર સમુદ્ર  
 (C) હિન્દ મહાસાગર  
 (D) એટલાંટિક મહાસાગર
- (૯) સમુદ્રતળના ભૂપૃષ્ઠનું આલેખન \_\_\_\_\_ બતાવવામાં આવે છે.  
 (A) હાઈથરગ્રાફ  
 (B) કંટૂર મેપ  
 (C) કલાઈમોગ્રાફ  
 (D) ડિઝ્સોગ્રાફિક વક્ક
- (૧૦) સમુદ્રજળની સરેરાશ ક્ષારતા \_\_\_\_\_ છે.  
 (A) 40%  
 (B) 20%  
 (C) 35%  
 (D) 25%
- (૧૧) નીચેનામાંથી \_\_\_\_\_ સમુદ્ર નિક્ષેપોનો પ્રકાર છે.  
 (A) જલજન્ય ગહન નિક્ષેપ  
 (B) અશ્માવલી નિક્ષેપ  
 (C) બ્રહ્માંડીય નિક્ષેપ  
 (D) ઉપરના બધા જ
- (૧૨) ક્યા મહાસાગરના પ્રવાહો અતુ પ્રમાણે તેની દિશા બદલે છે ?  
 (A) હિન્દ મહાસાગર  
 (B) પેસેફિક મહાસાગર  
 (C) આર્કટિક મહાસાગર  
 (D) એટલાંટિક મહાસાગર

(૧૩) સમુદ્ર મોજાના તરંગશીર્ષ અને તરંગપાદ વચ્ચેનું ઉર્ધ્વ અંતર \_\_\_\_\_ છે.

- (A) તરંગ માત્રા (B) તરંગ ઊંચાઈ  
(C) તરંગ સમય (D) તરંગ લંબાઈ

(૧૪) \_\_\_\_\_ સાગર ત્રણ મહાદ્વીપોની સીમાને સ્પર્શે છે.

- (A) કેરેબિયન સમુદ્ર (B) પીળો સમુદ્ર  
(C) ભૂમધ્ય સમુદ્ર (D) કાળો સમુદ્ર

(૧૫) ગ્રેટ બેરિયર રિફ \_\_\_\_\_ પાસે આવેલી છે.

- (A) આફિકા (B) યુરોપ  
(C) ઉત્તર અમેરિકા (D) ઓસ્ટ્રેલિયા

(૧૬) પૂનમ અને અમાસના દિવસે જે ભરતી આવે છે એને \_\_\_\_\_ ભરતી કહે છે.

- (A) ગુરુતમ (B) લઘુતમ  
(C) અર્ધદૈનિક (D) આમાંથી એક પણ નહીં

(૧૭) કંકણાકાર ખરાબા ક્યા આકારના હોય છે ?

- (A) ચોરસ (B) ઘોડાની નાળ  
(C) ત્રિકોણ (D) ઉપરના બધા

(૧૮) મહાસાગરોની સરેરાશ ઊંડાઈ કેટલી છે ?

- (A) 2000 મીટર (B) 800 મીટર  
(C) 3800 મીટર (D) 2500 મીટર

(૧૯) અલનીનો અને લા નીનો સમુદ્રપ્રવાહ \_\_\_\_\_ મહાસાગરમાં ઉદ્ભવે છે.

- (A) એટલાંટિક (B) આર્કટિક  
(C) હિન્દ (D) પેસેફિક

(૨૦) ક્યો મહાસાગર ભારતની દક્ષિણે આવેલો છે ?

- (A) હિન્દ મહાસાગર (B) એટલાંટિક  
(C) પેસેફિક (D) આર્કટિક

૨	સમુદ્રશાસ્ત્રનું અર્થ અને કાર્યક્ષેત્ર સમજવો.	૧૦
અથવા		
૨	સમુદ્રતળના ભૂપૃષ્ઠનું વર્ણન કરો.	૧૦
અથવા		
૩	સમુદ્ર કારતા પર અસર કરનારાં પરિબળોની ચર્ચા કરો.	૧૦
અથવા		
૪	(અ) નોંધ લખો : (કોઈ પણ એક)	૧૬
	(૧) પરવાળાના પ્રકારો	
	(૨) સમુદ્રમોજાના પ્રકારો	
(બ)	નોંધ લખો : (કોઈ પણ એક)	
	(૧) એટલાંટિક મહાસાગરના પ્રવાહો	
	(૨) સમુદ્ર પ્રવાહોની ઉત્પત્તિનાં પરિબળો.	
૫	ટૂંકમાં ઉત્તર લખો : (કોઈ પણ બે)	૧૪
	(૧) સમુદ્ર સંપત્તિ	
	(૨) સમુદ્રી પર્યાવરણની જગતવણી	
	(૩) સમુદ્રજળનું તાપમાન	
	(૪) ખંડીય છાજલીનું મહત્વ.	

## ENGLISH VERSION

**Instructions :** (1) All questions are compulsory.  
(2) Figure in the right side indicate the full marks of the questions.

**1** Give correct answer from the following M.C.Q. in your **20** answer book :

- (1) The average distribution of water and land are \_\_\_\_\_ on the earth surface.  
(A) 50% - 50%                          (B) 71% - 29%  
(C) 20% - 80%                          (D) 90% - 10%
  
- (2) \_\_\_\_\_ is not a type of coral reefs.  
(A) Fringing reef  
(B) Atoll  
(C) Racial reef  
(D) Barrier reef
  
- (3) The warm gulfstream and cold Labrador is meet near \_\_\_\_\_.  
(A) New York                              (B) Norway  
(C) Iceland                                (D) Newfoundland
  
- (4) The shallow, slow slope, broad and flat plain region of the ocean floor is known as \_\_\_\_\_.  
(A) Continental shelf  
(B) Trenches  
(C) Abyssal plains  
(D) Continental slope
  
- (5) Grant Bank is one of the important producer's of \_\_\_\_\_.  
(A) Nitrate                                (B) Marine fish  
(C) Bauxite                                (D) Mineral oil
  
- (6) The average temperature of the surface sea water is \_\_\_\_\_.  
(A) 17°C                                    (B) 40°C  
(C) 10°C                                    (D) 25°C

- (7) \_\_\_\_\_ covers the maximum 47% of the sea floor topography.
- (A) Continental shelf  
(B) The deeps  
(C) Deep sea plains  
(D) Continental slope
- (8) Which one of the following sea - ocean has the maximum salinity ?
- (A) Pacific Ocean                         (B) North Sea  
(C) Indian Ocean                             (D) Atlantic Ocean
- (9) How does the bottom topography of an ocean are shown ?
- (A) Hythergraph                             (B) Contour map  
(C) Climograph                                 (D) Hypsographic curve
- (10) The average salinity of the surface ocean is \_\_\_\_\_.  
(A) 40%   (B) 20%  
(C) 35%   (D) 25%
- (11) From the following \_\_\_\_\_ is a type of ocean deposit.
- (A) Pelagic deposits  
(B) Moraines deposits  
(C) Cosmogenetic deposits  
(D) All of these
- (12) Which ocean currents change their direction with seasons ?
- (A) Indian ocean                             (B) Pacific ocean  
(C) Arctic ocean                                 (D) Atlantic ocean
- (13) The vertical distance from crest and trough is \_\_\_\_\_.  
(A) Quantity of wave  
(B) Height of wave  
(C) Time of wave  
(D) Length of wave

- (14) Which of the following sea, touched its boundary to three continents ?
- (A) Caribbean    (B) Yellow  
(C) Mediterranean                                      (D) Black
- (15) The great barrier reef is found near \_\_\_\_\_.  
(A) Africa    (B) Europe  
(C) North America                                        (D) Australia
- (16) The tides which occurs on new moon and full moon day is called \_\_\_\_\_.  
(A) Spring tide     (B) Neap tides  
(C) Semidiurnal tide                                      (D) None of them
- (17) Which shape does the atoll reef has ?  
(A) Square    (B) Horse shoe  
(C) Triangular    (D) All of them
- (18) What is the average depth of the ocean ?  
(A) 2000 meter    (B) 800 meter  
(C) 3800 meter    (D) 2500 meter
- (19) Elnino and Lanino ocean currents are originate in \_\_\_\_\_ ocean.  
(A) Atlantic    (B) Arctic  
(C) Indian    (D) Pacific
- (20) Which ocean is located on the south of India ?  
(A) Pacific    (B) Atlantic  
(C) Indian Ocean    (D) Arctic

**2 Explain the meaning and scope of oceanography. 10**

**OR**

**2 Describe the relief of ocean floor. 10**

**3 Discuss the responsible factors for affecting the salinity of sea water. 10**

**OR**

**3 Explain the types of ocean deposits. 10**

**4 (a) Write note on : (any one) 16**

- (1) Types of coral reefs
- (2) Types of sea waves.

**(b) Write note on : (any one)**

- (1) Atlantic ocean currents
- (2) Responsible factors for the origin of ocean currents.

**5 Write answer in brief : (any two) 14**

- (1) Ocean wealth
  - (2) Conservation of ocean environment
  - (3) Temperature of sea water
  - (4) Importance of continental shelf.
-